

માર્ચ 29, 2018

## બ્રામ્પટન ફાયર લોકોનું જીવન બચાવવામાં મદદરૂપ થવા ડેટાનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યું છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – બ્રામ્પટન ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ (BFES) બ્રામ્પટનમાં પોતાના સાર્વજનિક શિક્ષણ કાર્યોને વેગમય બનાવવા અને અગ્નિ સુરક્ષા સુધારવા ડેટાનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યું છે.

આંતરિક (ઈન-હાઉસ) રોકોડર્સ, એન્વિરોનિક્સ ડેટા, અને અન્ય નવીન ટેકનોલોજીના મિશ્રણનો ઉપયોગ કરીને – BFES દ્વારા આ વિષયો પર સુદૃઢ સમજ કેળવવામાં આવી છે કે સમગ્ર બ્રામ્પટનમાં આગ ક્યાં લાગે છે, આગ લાગવા પાછળના કારણો શું છે અને એવી ઘણી બાબતો ખાસ કરીને, BFES દ્વારા આગ લાગવાની વધારે ઘટનાઓ થતી હોય તેવા ત્રણ પાડોશ ઓળખી કાઢવામાં આવ્યા અને તેના દરે ઘટાડવા પાંચ-વર્ષની યોજના વિગતવાર બનાવવામાં આવી.

આ ત્રણ પાડોશ છે, શહેરના દક્ષિણ છેડે સ્થિત આર્મબ્રો હાઈટ્સ, મધ્ય-પશ્ચિમી બ્રામ્પટનમાં રિજલિલ, અને બ્રામલી સીટી સેન્ટર શોપિંગ મોલને અડીને આવેલું સીટી સેન્ટર. આ ત્રણેય પ્રદેશો અને સંબંધિત અગ્નિ સુરક્ષા ચિંતાઓની વાત કહેવા, બ્રામ્પટન ફાયરે [નક્શો-આધારિત, વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન](#) વિકસાવ્યું. આ પ્રેઝન્ટેશન કોમ્પ્યુટર કે મોબાઈલ સાધન મારફતે સુલભ છે, અને બેકગ્રાઉન્ડ (પશ્ચાદભૂ) ડેટા દરેક વ્યક્તિ માટે ખુલ્લો હોય છે.

વર્ષ 2012 અને 2017 ની વચ્ચે, આ ત્રણ પ્રદેશોમાં લગભગ 250 વખત આગ લાગી, જે તમામ બ્રામ્પટન આવાસીય વિસ્તારોમાં લાગેલી આગનો 32 ટકા જેટલો આંકડો છે. આમાંની 30 અને 40 ટકા વચ્ચેની આગ રસોડામાંથી શરૂ થઈ હતી. ગેરેજમાં બારબેક્યુ વડે કે અન્ય કોઈ પદ્ધતિથી રાંધવાને લીધે અને ધૂમાડાની રાખ અયોગ્ય રીતે છોડવાથી પણ આગ લાગવાના કારણોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

કેટલાક લક્ષ્યાંકિત પાડોશમાં બહુમાળી આવાસીય ઈમારતો વિશાળ સંખ્યામાં છે, અને સામાન્ય રીતે, GTA દ્વારા દર વર્ષે બહુમાળી ઈમારતોમાં આગ લાગવાની સંખ્યામાં એકથી બે ટકાનો વધારો જોવામાં આવ્યો છે. બ્રામ્પટનમાં માત્ર 88 બહુમાળી એપાર્ટમેન્ટ ઈમારતો છે, પણ આ સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ તમામ આવાસીય આગ લાગવાની કુલ ઘટનાઓના 16 ટકા જેટલી છે.

BFES બહુવિધ-પાસાદાર સાર્વજનિક શિક્ષણ અને અગ્નિશમન પ્રયત્ન વડે પ્રતિભાવ આપી રહ્યું છે જેનું લક્ષ્ય આગામી પાંચ વર્ષે ઉપરાંતના સમયમાં આ વિસ્તારોમાં આગની ઘટનાઓની સંખ્યા ઘટાડવાનું છે. મહત્વના સંદેશાઓમાં રસોઈ બનતી હોય ત્યારે વ્યક્તિની અનુપસ્થિતિનો ભય અને સ્મોક એલાર્મ્સ કાર્યરત રાખવાના મહત્વનો સમાવેશ થાય છે.

વિતેલા છ મહિનાઓમાં, BFES દ્વારા આર્મબ્રો હાઈટ્સ, રિજલિલ અને સીટી સેન્ટરમાં જાહેરાત પ્રોત્સાહન પગલાઓ નીચે મુજબ વધારવામાં આવ્યા:

- ભૌગોલિક-સ્થિતિ આધારિત સોશિયલ મીડિયામાં જાહેરાત આપવી
- સ્થાનિક રિટેઈલ અને સામુદાયિક સ્થળોએ જાહેરાત આપવી
- ફાયર ટ્રક દ્વારા સંદેશાઓ આપવા
- બહુમાળી ઈમારતોની પરસાળમાં ટેલીવિઝન સ્ક્રીન્સ
- ઘરો, એપાર્ટમેન્ટ્સ, શાળાઓ અને સામુદાયિક મેળાવડાની જગ્યાઓની મુલાકાત લેવી
- સામુદાયિક પ્રસંગોમાં સહભાગી થવું

તમામ બ્રામ્પટન ફાયરફાઇટર્સને (અગ્નિશામક દળોને) પ્રમાણિત લેવલ વન ફાયર સેફ્ટી એજ્યુકેટર (સ્તર એકની અગ્નિ સુરક્ષા શિક્ષક) સમકક્ષ તાલીમ આપવામાં આવી છે. અગ્નિ નિવારક અધિકારીઓ સુરક્ષા નિરીક્ષણો કરી રહ્યાં છે, જેમાં બહુમાળી ઈમારતો અને વૃદ્ધોના ઘરો જેવા આગ લાગવામાં ભેદ મકાનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

આજની તારીખ સુધીમાં, ત્રણેય પ્રદેશોમાં લગભગ 7,000 એલીમેન્ટરી અને હાઈ સ્કૂલ વિદ્યાર્થીઓએ અગ્નિ સુરક્ષા પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો છે. 2,500 ઉપરાંત બહુમાળી આવાસોમાં સ્થળલક્ષી માહિતી તેઓને વિતરિત કરવામાં આવી હતી, અને 1,000 ઉપરાંત રહેવાસીઓએ અગ્નિ સુરક્ષા વિશે અગ્નિશમન કર્મચારીઓ સાથે વાતચીત કરી છે.

વધુ સાર્વજનિક શિક્ષણનું આયોજન આગામી મહિનાઓમાં કરવામાં આવ્યું છે. અગ્નિ સુરક્ષા અંગે માહિતી મેળવવા, કૃપા કરી વેબસાઇટ જુઓ, [www.bramptonfire.com](http://www.bramptonfire.com)

### સરળ અગ્નિ સુરક્ષાને લગતી ખાસ માહિતી:

- રસોઈ કરતી વખતે હંમેશા રસોડામાં રહો, અને તમે ઊંઘતા હો ત્યારે રસોઈ ક્યારેય બનાવશો નહીં.
- તમારા ગેરેજમાં બારબેક્યુ કે અન્ય ફૂકર્સનો ઉપયોગ ક્યારેય કરશો નહીં.
- તમારા ઘરના દરેક માળ અને તમામ સૂવાની જગ્યાઓની બહાર સ્મોક એલાર્મ્સ બેસાડો.
- વધારાના સંરક્ષણ માટે, ઉત્પાદકની ભલામણો અનુસાર દરેક બેડરૂમમાં સ્મોક એલાર્મ્સ બેસાડો.
- દર મહિને ટેસ્ટ બટન દબાવીને સ્મોક અને કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સનું પરીક્ષણ કરો. બેટરી દર વર્ષે બદલો.
- સમય વિતવાની સાથે સ્મોક અને કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ નકામા થઈ જાય છે. ઉત્પાદકની ભલામણો અનુસાર એલાર્મ્સ બદલો.
- જો તમે ધૂમ્રપાન કરતા હો, તો સાવધ રહો અને ઊંડી એશટ્રે વાપરો.

### અવતરણો (ક્વોટ્સ):

“બ્રામ્પટન ફાયર કેનેડામાં આપણાં શહેરમાં અગ્નિ સુરક્ષાને લગતી ચિંતાકીય બાબતો ઓળખવા અને તેનો સામનો કરવા વ્યૂહરચનાઓ વિકસાવવા સાધનો અને ટેકનોલોજી વાપરવામાં, ફરીથી આગેવાન રહ્યું છે. આપણાં રહેવાસીઓની સુરક્ષા આપણી અગ્રતા છે, અને હું આગામી અઠવાડિયાઓમાં બ્રામ્પટન ફાયરના સુરક્ષા શિક્ષણ પ્રયત્નોને સહાયતા કરવા માટે આશાવાદી છું.”

- મેયર લિન્ડા જેફરી (Linda Jeffery)

“રસોઈ બનતી હોય ત્યારે વ્યક્તિની અનુપસ્થિતિ અને સ્મોક એલાર્મ્સ બ્રામ્પટનમાં ચિંતાકીય બાબત તરીકે ચાલુ રહ્યા છે – ન કેવળ લક્ષ્યાંકિત વિસ્તારોમાં, પરંતુ સમગ્ર શહેરમાં. અમે જાણીએ છીએ કે કાર્યરત સ્મોક એલાર્મ્સ જીવન બચાવે છે; ખાતરી કરો કે તમે તમારા ઘરના દરેક માળ પર, તમામ સૂવાની જગ્યાઓની બહાર એલાર્મ્સ બેસાડ્યા છે, અને રસોઈ બનાવતી વખતે ક્યારેય અનુપસ્થિત રહેશો નહીં.”

- પ્રાદેશિક કાઉન્સિલર અને ચેરમેન, સામુદાયિક સેવાઓ, માઈકલ પાલેશી (Michael Palleschi)

“આપણાં સમુદાયમાં જોખમ ઘટાડો યોજના આપણાં સૌ માટે એક અગ્રતા પ્રોજેક્ટ છે. મને વિશ્વાસ છે કે તાલીમ અને સાર્વજનિક શિક્ષણ પર આપણો વધારાના પ્રયત્નથી, ત્રણેય મહત્વના વિસ્તારોને લક્ષ્યાંકિત કરવાથી, બ્રામ્પટન રહેવાસીઓના જીવન પર હકારાત્મક પ્રભાવ પડશે.”

- ફાયર ચીફ બિલ બોયસ (Bill Boyes)

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)